

7NR RETAIL LIMITED

CIN: L52320GJ2012PLC073076

Regd. Office: Godown No-1, 234/1+234/2, FP-69/3, Sadashiv Kanto,
B/h Bajaj Process, NarolChokdi, Narol, Ahmedabad - 382 405

E-mail: info@7nrretailtd.in

Date: 12th February, 2022

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street,
Mumbai – 400001

Dear Sir/Ma'am,

**Sub: Newspaper Advertisement of extract of Unaudited Financial Results for the
Quarter and Nine Months ended on 31st December, 2021**

Ref: Security Id: 7NR / Code: 540615

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement on 12th February, 2022 of Unaudited Financial Result for the Quarter and Nine Months ended 31st December, 2021 in:

1. English Newspaper – Free Press Gujarat and
2. Regional Language Newspaper (Gujarati) – Lokmitra

Kindly take the same on your record and oblige us.

Thanking You,

Yours Faithfully

For, 7NR Retail Limited

Tarachand Agrawal
Director
DIN: 00465635

'Told home minister about CP's demand 2 months ago' 'Gujarat units don't need fire NOC for licence'



Rajkot: Addressing the media once again on Wednesday after recording their statements with the probe committee on Tuesday, the Sakhiya brother duo reiterated that the home minister for state, Harsh Sanghvi was aware of the extortion allegation that had been raised against Rajkot police commissioner Manoj Agarwal. The duo, who also provided technical evidence to the committee, stated that the minister was apprised of the graft allegations two and half months ago. In the meantime, the probe into the high-level corruption allegations against Rajkot police commissioner Manoj Agarwal was handed over to Vikas Sahay by the state government after a letter written by Rajkot south constituency MLA Govind Patel on the matter came into the limelight last Saturday.

complainant in the Rs 16 crore fraud case, Mahesh Sakhiya and his son Kisan, and also Mahesh's elder brother Jagjivan Sakhiya, who had approached Rajkot police commissioner Manoj Agarwal with a request to lodge an FIR in the case eight months ago, for eight long hours till 11pm on Tuesday in Gandhinagar. A statement of a witness was also recorded whose name is not made public for security reasons and they also provided technical evidence to the probe committee. Talking to the mediapersons, the brother duo expressed their satisfaction over the probe. The brothers said that nearly 22 pages of statements from four people had been recorded.

"I first met home minister Harsh Sanghvi two and half months ago along with Govindbhai Patel (BJP MLA) and Rambhai Mokariya (RS MP). I handed him my application and told him everything about the matter.

He (Sanghvi) had assured me to take action then, but thereafter no action was taken on it, perhaps, as he was new in the office," said Mahesh.

Rajkot: Testimony of a three-year-old boy played a pivotal role in the conviction of a man who had killed his elder brother and buried his body in a natural drain in Moti Khavdi village of Jamnagar in 2017. Jamnagar additional sessions judge Tejas R Desai on Tuesday sentenced Shivnath Ramakant (30) to life imprisonment and fined him Rs 17,000 for smothering five-year-old Amarjit Sakhaldev following a rift with his parents over unpaid canteen food bill. Additional public prosecutor Hemendra Mehta said that statement of the victim's younger brother Satyam, who was three years old then (now aged 8 years) played a vital role in this case. "It was Satyam who had led the police to his brother's killer. During the trial, judge Desai recorded Satyam's statement (in 2019) by sitting beside him in a way that the child did not feel scared," Mehta told TOI.

He added that matching of clay from the place where the victim's body was buried with that of mud found on the accused, other evidence and statements of family members helped prove that Shivnath was the killer. The court also found Shivnath guilty of kidnapping and destruction of evidence. According to case details, Shivnath and the victim's father Manoj Kumar Sakhaldev, a native of Bihar, worked as labourers in a private company in Moti Khavdi and lived in the same labour colony near the factory. Manoj's

Three-year-old helps convict his brother's killer

wife Sushila ran a canteen where Shivnath ate regularly. Since Shivnath did not pay for the food for two months, Sushila started reminding him of payment of dues. Shivnath got irritated by the constant demand for payment of outstanding bills. On May 31, 2017 when Manoj's sons Amarjit and 3-year-old Satyam were playing outside their house, Shivnath lured them with the promise of ice cream and took the two boys with him.

applying to get or renew a factory licence. A resolution was issued by the labour, skill development and employment department on Wednesday. This bizarre policy is because the urban development department and the labour department have not been able to coordinate and resolve the issue of who will issue fire NOCs to industry, since July last year, sending industrial units in the state into a tizzy.

Strangely, the GR, a copy of which is with, comes at a time when Gujarat has the highest number of Major Accident Hazard (MAH) industrial units in the country.

Industrial fires have claimed 120 lives in the state since 2014, according to the state's own figures. The GR was issued by

deputy secretary Ajit Mavani of the labour department after frequent representations were made by various industrial lobbies, on how export and import licences and even building (BU) permissions were affected because the eight municipal authorities and nagarpalikas now have no authority to issue fire NOCs to industrial units. After this, the labour department on Wednesday simply struck off the mandatory fire NOC requirement under the Factories Act 1948 to speed up the licence renewal process. Who will issue fire NOCs to industrial units is an issue that is has not yet been addressed.

In January 2021, a notification was issued under the Gujarat Fire

Prevention and Life Safety Measures Act, which defines various categories of buildings — residential, institutional, commercial and industrial — and the authorities responsible for issuing fire NOCs to them. In July, the UD department withdrew the authority of urban local bodies to issue fire NOCs. A senior official of the Gujarat Industrial Development Corporation (GIDC) told TOI, "The nonchalance of both the labour and urban development department towards resolving the issue is the reason for this confusion. For preventing industrial accidents, the state government carries out inspections according to Factories Act 1948 and Gujarat Factories Act 1963."

Class 9 boy hangs self to death at home

Surat: A 15-year-old boy studying in Class 9 hanged himself to death at his home in Sachin GIDC area on Tuesday evening. The deceased was identified as Utkarsh, son of a security guard who lives with his parents and elder brother. According to police, on Tuesday, Utkarsh went to school, his brother left for college and their parents went to work as usual.

At about 5:30pm when Utkarsh's elder brother returned home Utkarsh did not open the door. His brother made several calls on Utkarsh's mobile phone but he did not answer it.

One of Utkarsh's friends climbed to the kitchen door on the first floor and found Utkarsh hanging by dupatta to a window grill. He opened the main door and informed Utkarsh's elder brother. He was rushed to the hospital but was declared dead on arrival.

Police have registered a case of accidental death and said that reason for Utkarsh's extreme step was not known.

Arthur D. Little, A&W Capital, Bain & Company, Boston Consulting Group, Sanford C. Bernstein, Citibank, EY Parthenon, Goldman Sachs, JP Morgan Chase & Co, Kearney, McKinsey & Company, Monitor Deloitte, Oliver Wyman, Premji Invest, PwC, Standard Chartered, and The Xander Group among others. Goldman Sachs made the

highest number of offers (including pre-placement offers) — 7, closely followed by American Express — 5 in Cluster 1.

Finance firms offered roles in investment banking, private equity, venture capital capital markets across functions. The second cluster of placement process is scheduled on February 11.

Gujarat: BCG emerges top recruiter at IIM-A



Ahmedabad : Boston Consulting Group (BCG) emerged as the top recruiter at the end of first cluster of final placement process for the post graduate programme (PGP) class of 2022 held Wednesday at the Indian Institute of Management Ahmedabad (IIM-A).

highest number of offers (including pre-placement offers) — 7, closely followed by American Express — 5 in Cluster 1.

Finance firms offered roles in investment banking, private equity, venture capital capital markets across functions. The second cluster of placement process is scheduled on February 11.

Arthur D. Little, A&W Capital, Bain & Company, Boston Consulting Group, Sanford C. Bernstein, Citibank, EY Parthenon, Goldman Sachs, JP Morgan Chase & Co, Kearney, McKinsey & Company, Monitor Deloitte, Oliver Wyman, Premji Invest, PwC, Standard Chartered, and The Xander Group among others. Goldman Sachs made the

7NR RETAIL LIMITED

CIN: L52320G32012PLC073076
Address: Godown No-1, 234/1+234/2, FP-69/3, Sadashiv Kantli, B/H Bajaj Process, Narol Chokdi, Narol Ahmedabad- 382 405

Extract of Unaudited Financial Results for the Quarter ended 31/12/2021 (Rs. in Lakhs except EPS)				
Sr. No	Particulars	Quarter Ending on 31.12.2021	Year to Date Figures 31.12.2021	Corresponding Three Months Ended in the Previous Year 31.12.2020
1	Total Income from operations (net)	953	2213.39	93.6
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	37.69	59.14	0.59
3	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	37.69	59.14	0.59
4	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	27.89	59.14	0.59
5	Total Comprehensive Income for the period (after Tax)	27.89	59.14	0.59
6	Equity Share Capital	1047.45	1047.45	1047.45
7	Other Equity			
8	Face Value of Equity Share Capital	10/-	10/-	10/-
9	Earnings Per Share (Basic / Diluted)	0.03	0.06	0.00

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 23 of the SEBI (LODR) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website i.e. www.bseindia.com.

For 7NR RETAIL LIMITED
Sd/-
Tarachand Agrwal
Director
DIN:00465635

3 of Mumbai family killed in road accident

Rajkot: Three members of a family from Kutuch, who are settled in Mumbai for many years, were killed in an accident on the Ahmedabad-Kutch highway early on Wednesday. The family of five had started for their native Desalpur village in Rapar taluka to attend a religious function and a marriage on Wednesday.

However, while trying to overtake, their SUV hit a trailer near Halvad town. Their SUV veered off the highway and plunged into the roadside.

The deceased were identified as Saamu Patel, her son Ramesh and Monghi Patel. Saamu's husband Vasta Patel and Monghi's son Rutwik were injured in the accident, said Halvad police station sources.

While BCG made 47 offers, Accenture Strategy was also among the top recruiters with 32 offers across 2 roles in the cluster 1 process. The list of cluster 1 recruiters included regular partners including American Express, ARGA Investment Management LP,

ECS Biztech Limited

CIN: L30070G32012PLC063070
Registered Office : B-02, THE FIRST, ECS Corporate House, Behind Keshavnagar Party Plot, Off 132 Ft. Road, Vastropur, Ahmedabad - 380015, Gujarat.
Phone : +91-8980005048 E-mail : secretarial@ecscorporation.com | Website: www.ecscorporation.com

Extract of Unaudited Standalone Financial Results for the Quarter and Nine Months ended on 31st December, 2021 (In Rupees)				
Sr. No.	Particulars	Standalone		
		Quarter ended 31-12-2021	Quarter ended 31-12-2020	Quarter ended 31-12-2021
1	Total Income from operations	6,245,538	5,982,732	11,931,524
2	Other Income	240	123,394	236,556
3	Total Income (1+2)	4,545,778	5,605,626	11,667,992
4	Profit before Exceptional Items and Tax	15,521	(21,879,879)	(3,550,980)
5	Profit before Tax	15,521	(21,879,879)	(3,550,980)
6	Net Profit for the period	15,521	(21,879,879)	(3,550,980)
7	Total Comprehensive Income for the period	15,521	(21,879,879)	(3,550,980)
8	Fixed-up Equity Share Capital (Face Value of Rs. 10/- each per Share)	205,550,470	205,550,470	205,550,470
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each (Net Annualised)	0.06	(1.06)	(0.17)
10	Diluted (Rs.)	0.06	(1.06)	(0.17)
11	Weighted (Rs.)	0.06	(1.06)	(0.17)

Note: The above Un-audited Standalone financial results for the Quarter and Nine months ended 31st December 2021, have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 11th February, 2022 and the Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company.

The above is an extract of the detailed format of Standalone Unaudited Financial Results for the Quarter and Nine months ended on 31st December, 2021 filed with the Stock Exchange under Regulation 23 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Standalone Financial Results for the Quarter and Nine months ended on 31st December, 2021 are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.ecscorporation.com

For and on behalf of the Board For ECS Biztech Limited
Sd/-
Vijay M. Mandora
Managing Director
(DIN: 00328792)

Date: 11-02-2022
Place: Ahmedabad

SHRIRAM CITY UNION FINANCE LIMITED

Head Office: Level - 3, Wockhardt Towers, East Wing C-2 Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051; Tel: 022 4241 0400; 022 4060 3100 | Website: http://www.shriramcity.in | Registered Office: No. 123, Angappa Naicken Street, Chennai - 600 011 | Branch Office: 901 To 904, TITANIUM SQUARE, NR ADJAN GAM CIRCALE, OPP INCOME TAX OFFICE, ADJAN, SURAT-395009

APPENDIX-IV-A [SEE PROVISION TO RULE 8(6)] [SEE NOTICE FOR SALE OF IMMovable PROPERTIES]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described immovable properties mortgaged/charged to the Shriram City Union Finance Limited. The Physical possession of which have been taken by the Authorized Officer of the Shriram City Union Finance Limited, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis in accordance with the Sale Act for recovery of the balance due to the Shriram City Union Finance Limited from the Borrowers And Guarantors, as mentioned in the table. Details of Borrowers and Guarantors, amount due, Short Description of the immovable property and encumbrances known thereon, possession type, reserve price and earnest money deposit, Date and Time of Auction are also given as:

Name of Borrowers/Co-Borrowers/ Guarantors/Mortgagers	Date & Amount of Demand Notice	Total Outstanding Amount	Description of Property	Reserve Price (Rs.) & Bid Increment	Earnest Money Deposit Details (EMD) Details.	Date & Time of Auction	Contact Person
1) PATEL ASSOCIATES (Partner BHARATHBHAI MOHANBHAI KOTADIYA)	Rs. 1,55,03,013/- (Rupees One Crore Fifty Five Lakh Three Thousand Thirteen Only)	Rs. 1,65,15,23 (Rupees One Crore Sixty Five Lakh mouje Valanja Fifteen Thousand Two Hundred Thirty Nine Only) as per dated. 09/2/2022	Schedule of the Property Registration District and Sub District Karmajouje Valanja B l o c k N o 8 4, Survey No 6 6 / 2	1,28,00,000/- (Rupees One Crore Twenty Eight Lakh only)	EMD amount to be deposited by way of RTGS/ NEFT to the account details mentioned herein below:	16th March 2022	Customer Care Number: 022 - 40081572 & Time: 11.00 am to 01.00 p.m.
2) G 22 GRD FLOOR SARGAM COMPLEX DOCTOR HOUSE.NEAR HIRABAG,VARACHHA ROAD ,SURAT, 395006	Notice dated: 21/10/2021	Rs. 1,28,00,000/- (One Lakh Only)	District Sur District Karmajouje Valanja B l o c k N o 8 4, Survey No 6 6 / 2	Rs. 1,00,00,000/- (One Lakh Only)	BANK NAME- AXIS BANK LIMITED BRANCH DR.	11.00 am to 01.00 p.m.	Mr.Jignesh Kansara 9376902005
3) BHARATHBHAI MOHANBHAI KOTADIYA	93 SHANTI NIKETAN SOCIETY,SURAT,VARACHHA ROAD, SURAT, GUJARAT,395006	Two Hundred Thirty Nine	1070 sq.mtrs. and bounded as under.	North : Limit Of Rs 12,80,000/- (Rupees Twelve Lakh Eight Thousand Only)	BANK ACCOUNT NO. CURRENT ACCOUNT NO. 0060102000657449	14th March 2022	Mr. Hiteshkumar Joshi 9879940713
4) KAMELASHBHAI D SUHAGIYA A 48 VANANDA SOCIETY VIBHAG.1 SURAT,VARACHHA ROAD, SURAT, GUJARAT,395006	93 SHANTI NIKETAN SOCIETY, SURAT, VARACHHA ROAD, SURAT, GUJARAT,395006	North : Limit Of Rs 12,80,000/- (Rupees Twelve Lakh Eight Thousand Only)	South: Limit Of Rs 12,80,000/- (Rupees Twelve Lakh Eight Thousand Only)	East: By limit of Rs 12,80,000/-	UTB0000006	Time 11.00 am to 1.00 p.m.	Property Inspection Date: 14th March 2022
5) PATEL INFRASTRUCTURE (Partner BHARATHBHAI MOHANBHAI KOTADIYA)	G 22 GRD FLOOR SARGAM COMPLEX DOCTOR HOUSE.NEAR HIRABAG,VARACHHA ROAD ,SURAT, GUJARAT,395006	Rs. 12,80,000/- (Rupees Twelve Lakh Eight Thousand Only)	Physical Possession	West: By Road	Last Date for Submission of EMD. 15th March, 2022, Time 10.00 am to 05.00 p.m.	Website of the service provider https://auctons.sbi.mil.in for bid documents the details of the secured asset put up for auction/ obtaining the bid form	
6) YOGESH R KOTADIYA 35 96 GITANJALI ROW H.O,SURAT.A. K. ROAD, SURAT, GUJARAT,395008	Encumbrances known Not Known	Rs. 12,80,000/- (Rupees Twelve Lakh Eight Thousand Only)					

For detailed terms and conditions of the sale, please refer to the <http://shriramcity.in/e-auction-Residential.php> provided in the Shriram City Union Finance Limited website.

The online auction will be conducted on website <https://auctons.saml.in> or our auction agency M/s. Shriram Automail India Limited (SAMLI), and refer this for auction training, place of bid documents, details of secured assets and Tender Submission. Contact to M/s. Shriram Automail India Limited (SAMLI) Ajay Rastadiya & Mobile No. + 91-9512448060 E-mail ID: ajay.rastadiya@123done.com, Mr. Mahesh Bangera-9004173256

STATORY 30 DAYS SALE NOTICE FOR SUBSEQUENT SALE UNDER RULE 8(6) AS PER AMENDED SARFAESI ACT, 2002. The mortgagors/borrowers are given a last chance to pay the total dues with further interest before auction, failing which secured assets will be sold as per above schedule.

NB: Please note that the secured creditor is going to issue the sale notice to all the Borrowers/ Guarantors/ Mortgagers by speed/ registered post. In case the same is not received by any of the parties, then this publication of sale notice may be treated as a substituted mode of service.

Place : Surat
Date : 12-02-2022

Sd/- Authorised Officer
Shriram City Union Finance Ltd

Cholamandalam Investment & Finance Company Limited

REGISTERED OFFICE: Cholamandalam Investment & Finance Company Limited (CIFCL), Clare House, 1st Floor, 2, NSC Bose Road, Chennai 600001 | CIN: L65993TN1979FC0007376.

SALE NOTICE FOR SALE OF IMMovable PROPERTIES

E-auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower / Co-Borrower/ Mortgager (s) that the below described immovable properties mortgaged to the Secured Creditor, the constructive/physical possession of which has been taken by the Authorized Officer of M/s Cholamandalam Investment and Finance Company Limited the same shall be referred herein after as "Secured Assets" will be sold on "As is where is", "As is what is", "As is what is" and "Whatever there is" basis through E-Auction for recovery of amount mentioned in the table below with further interest, cost, charges and expenses being due to RRFI, viz. Secured Creditor.

It is hereby informed to General public that we are going to conduct public E-Auction through website <https://sarfaesi.auctiontender.net>

S. No.	Account No. and Name of borrower, Co-borrower, Mortgagers	Date & Amount per Demand Notice Us 15/2	Descriptions of the property/Properties	Reserve Price Earnest Money Deposit Bid Increment Amount (In Rs.)	E-Auction Date and Time
					EMD Submission Last Date & Time Inspection Date and Submission of Bids and Documents
1	XHILAMEN001607304 1.Mr. JAMIN HASMUKHIBHAI M.D-33, SHETAL NATH SOC, KATHWADA ROAD, AHMEDABAD- 382338 2. Mrs. KRINA JAMIN AMIN, D-33, SHETAL NATH SOC, KATHWADA ROAD, AHMEDABAD- 382338	Rs. 46,47,000/- Rs. 46,47,000/- Rs. 46,47,000/-	All that right, title and interest of Plot No.D/888 on 8th Floor, Block No. D, 'Yastul', Prabhu C.opp. Housing Society Ltd., Near Nri Tower Bodakey, Village-1 comprised in Revenue Survey No. 2423/1, 2423/2, 2424, 2425, 2426/1, 2426/2, TRS No. 1B, P. No.152 Mouje: Bodakey Taluka, Ghataldyo, Dist & Sub-District: Ahmedabad, measuring 100.34 Sq. Mts.	Rs. 50,92,000/- 10,000/-	02/03/2022, 11.00 am to 01.00 pm 01/03/2022, upto 5.00 pm each (With unlimited extension of 5 min each) 24/02/2022 and 25/02/2022 90, NRI, Sakar 2, Beside Elitbridge, Police Station, Asaram Road, Ellorabidge, Ahmedabad - 380006

1. All interested participants/ bidders are requested to visit the website <https://sarfaesi.auctiontender.net> and <https://www.cholamandalam.com/Auction/Notice.aspx> For details, file, procedure and online training on e-auction, prospective bidders may contact M/s e-Procurement Technologies Ltd., Contact Mr.Ram Sharma Contact Number: 800022297/079-61819303. Email id: ramrassad@auctiontender.net, support@auctiontender.net.

2. The E-Auction sale of Secured Assets is on "as is where is", "as is what is", "as is what is" and "no recourse" basis for and on behalf of the Secured Creditor viz. M/s Cholamandalam Investment and Finance Company Limited and there is no known encumbrance which exists on the said property.

3. For participating in online auction sale, Bid document, copies of PAN Card, Board Resolution in case of Company and photo ID, address proof are required to be submitted along with EMD, which is payable by way of DEMAND DRAFT M/s Cholamandalam Investment and Finance Company Limited. Further the bidder is required to hand over the D/D to Branch Manager.

4. All interested participants/ bidders are requested to visit the website <https://sarfaesi.auctiontender.net> for further details including Terms & Conditions, to take part in e-auction sale proceeding and also advised to contact M/s Vibha B. Sarad Contact Number 8530222916 and e-mail vibhasarad@nri.murgurap.com.

5. The successful Bidder will be required to deposit 25% of the sale price (including the EMD already deposited) on the same day or not later than working day of the acceptance of bid. The balance amount of the sale price is to be paid within 15 days of the confirmation of the sale. In case of failure to deposit the balance amount within the prescribed period, the amount of EMD and/or deposited amount shall forfeited and no claim shall be entertained.

6. The secured asset mentioned above is presently in the Physical possession of the Authorized Officer of M/s Cholamandalam Investment and Finance Company Limited (AO). On conclusion of the e-auction sale and on receipt of the entire sale consideration, the possession of the Secured Assets shall be handed over to the successful bidder by the AO M/s Cholamandalam Investment and Finance Company Limited.

Note: Other Detail Terms and Conditions of the e-auction will be made available on <https://sarfaesi.auctiontender.net>

Date: 12-02-2022
Place: Gujarat

This IS ALSO A STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.

Sd/- Authorised Officer
M/s Cholamandalam Investment and Finance Company Limited

